https://archive.org/details/bk1420/page/n0/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૭, અંક : ૪, સળંગ અંક : ૭૬, જૂન - ૨૦૧૮
દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક

સત્પંથ પ્રકાશ

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંચસ્થ બિરાજમાન
પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતો તેમજ ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો
જામરેલાકંપા, તા. વડાલી (તા. ૧૭-૫-૨૦૧૮)

છૂટક કિંમત : ૯=૦૦ રૂા. / વા. લ. ૧૦૦=૦૦ રૂા.

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 9, 10, 11, 13, 14, 16.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 15:02:00 +05'30'
Real Patidar
Unravel Truth

realpatidar.com

વર્ષ : ૭, અંક : ૪, સળંગ અંક : ૭૬, જૂન - ૨૦૧૮
દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક

સત્પંથ પ્રકાશ

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંચસ્થ બિરાજમાન
પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતો તેમજ ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો
જામરેલાકંપા, તા. વડાલી (તા. ૧૭-૫-૨૦૧૮)

છૂટક કિંમત : ૬=૦૦ રૂ. / વા. લ. ૧૦૦=૦૦ રૂ.

Jamrela Kampa, Vadali, Satpanth Temple / Khana

.com

https://archive.org/details/bk1420/page/n3/mode/1up

realpatidar.com

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મુ. જામરેલાકંપા, તા. વડાલી, જી. સાબરકાંઠા (તા. ૧૭-૫-૨૦૧૮)

ઉપરોક્ત પ્રસંગે સંતોનાં ભવ્ય સ્વાગત સામૈયાં તથા શોભાયાત્રા

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની વૈદિક મંત્રોચ્ચારસહ પૂજન-પ્રાણ પ્રતિષ્ઠા કરી રહેલી પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતો.

ઉપરોક્ત પ્રસંગે સદ્‌ગુરુનાં નિશાન તથા છડીનાં પૂજન-અર્ચન કરતા જામરેલાકંપાના ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરનું વૈદિક મંત્રોચ્ચારસહ વિધિવત્‌ ઉદ્‌ઘાટન કરતા પૂ. જગદ્‌ગુરુ શ્રી તથા સંતો.

ઉપરોક્ત પ્રસંગે વારિયજ્ઞ-મહાપૂજા

realpatidar.com

realpatidar.com

બ્રહ્મલીન પ.પૂ. સંત શ્રી નારણબાપાના અંતિમયાત્રા પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ

નારાયણધામ- મેત્રાલકંપા, તા. ખેડબ્રહ્મા. (તા. ૧૫-૫-૨૦૧૮)



બ્રહ્મલીન પૂ. સંત શ્રી નારણબાપા

ઉપરોક્ત પ્રસંગે પૂ. મહામંડલેશ્વર મહંત શ્રી જન નાર્દનહરિજી મહારાજ પુષ્પાંજલિ અર્પણ કરે છે.

ઉપરોક્ત પ્રસંગે પૂ. મહંત શ્રી દિવ્યાનંદજી મહારાજ તથા બ્રહ્મલીન પૂ. નારણબાપાના પરિવારજનો પુષ્પાંજલિ અર્પણ કરે છે.

બ્રહ્મલીન પૂ. સંત શ્રી નારણબાપાની અંતિમપાલખી યાત્રા પ્રસંગે પૂ. મહામંડલેશ્વર મહંત શ્રી જનાર્દનહરિજી મહારાજ, પૂ. મહંત શ્રી દિવ્યાનંદજી મહારાજ, ભાવિક હરિભક્તો તથા સાંસારિક પરિવારજનો

બ્રહ્મલીન પૂ. સંત શ્રી નારણબાપાની અંતિમ સમાધિ સંસ્કાર વિધિ

realpatidar.com

realpatidar.com

બ્રહ્મલીન પ.પૂ. સંત શ્રી નારણબાપાના અંતિમયાત્રા પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

ઉપરોક્ત પ્રસંગે પૂ. મહામંડલેશ્વર મહંત શ્રી જનાર્દનહરિજી મહારાજ, પૂ. સંત શ્રી તુલસીબાપા શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

ઉપરોક્ત પ્રસંગે પૂ. સંત શ્રી શાંતિદાસ મહારાજ તથા પૂ. શ્રી ગંગારામભાઈ વકીલ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

ઉપરોક્ત પ્રસંગે પૂ. શ્રી ખીમજીબાપા (ટ્રસ્ટીશ્રી ઈમામશાહ મહારાજ સંસ્થા) તથા પરિવારજનો શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

બ્રહ્મલીન પૂ. સંત શ્રી નારણબાપાના સમાધિ મંદિરનું વિધિવત્ ઉદ્‌ઘાટન પૂ. સંત તુલસીબાપા કરી રહ્યા છે.

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n6/mode/1up

realpatidar.com

શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મુ. બડોલ કંપા, તા. વડાલી, જી. સાબરકાંઠા (તા. ૧૮-૫-૨૦૧૮)

ઉપરોક્ત પ્રસંગે સંતો-મહંતોનાં ભવ્ય સ્વાગત-સામૈયાં

ઉપરોક્ત પ્રસંગે ભવ્ય શોભાયાત્રામાં પૂ. જીગદ્‌ગુરુશ્રી તથા સંતો

સંતોના સ્વાગત-પૂજન

ઉપરોક્ત પ્રસંગે ભવ્ય શોભાયાત્રામાં સંતો-મહંતો વગેરે

ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસન, ધર્મધ્વજા તથા શિખર-કળશની વૈદિક મંત્રોચ્ચાર સહ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ બ્રહ્મા-વિષ્ણુ-મહેશના પ્રતિકનું પૂજન કરતા પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો.

realpatidar.com

realpatidar.com

સત્પંથ પ્રકાશ

વર્ષ : ૭, અંક : ૪, સળંગ અંક : ૭૬, જૂન - ૨૦૧૮

:: સ્થાપકશ્રી ::
શ્રી શામજીભાઈ કે. પટેલ - વડાગામ

:: સંપાદકશ્રી ::
શ્રી શાંતિભાઈ ડી. પટેલ - મુંબઈ

:: સહ સંપાદકશ્રી ::
શ્રી બાબુભાઈ એસ. પટેલ - અમદાવાદ

:: સત્પંથ પ્રકાશન સમિતિ ::

:: પ્રમુખશ્રી ::
શ્રી મનોજભાઈ એન. પટેલ - વડોદરા

:: મંત્રીશ્રી ::
શ્રી જશુભાઈ કે. પટેલ - વિઠ્ઠલપુરા લાટ

:: સહ મંત્રીશ્રી ::
શ્રી સુરેશભાઈ એમ. પટેલ - અમદાવાદ

:: સદસ્યશ્રીઓ ::
શ્રી પ્રિ. સુરેશભાઈ એસ. પટેલ - ખેડબ્રહ્મા
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી - માંડવી
શ્રી નારણભાઈ ડી. પટેલ - પૂના
શ્રી અંબાલાલ પી. પટેલ - રામાપીરકંપા
શ્રી અમૃતલાલ જે. રૂડાણી - નાના અંગીયા
શ્રી હર્ષદકુમાર જે. પટેલ - પીરાણા લાટ

:: સલાહકારશ્રીઓ ::
શ્રી સામજીભાઈ એલ. ધોળુ - વડોદરા
શ્રી કરશનભાઈ વી. પટેલ - ધનસુરા

:: સત્પંથ પ્રકાશ - લવાજમ દર ::

		ભારતમાં		વિદેશમાં
વાર્ષિક	:	૧૦૦=૦૦	:	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	:	૨૫૦=૦૦	:	૧૮૦૦=૦૦
આજીવન	:	૮૫૦=૦૦	:	૪૦૦૦=૦૦
અમર	:	૧૫૦૦=૦૦	:	૭૦૦૦=૦૦

:: પ્રકાશક ::
સત્પંથ પ્રકાશન સમિતિ,
પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫.

E-mail : satpanthprakash@gmail.com
(Contact : Mob. No. 9512993899)

Website : www.nishklankinarayan.com

કુરીયર્સ : મારૂતિ કુરીયર્સ, બારેજા - અમદાવાદ.
C/o. સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.

સંપર્ક : ધર્મેન્દ્ર પટેલ - બુક સ્ટોલ
મો. ૯૪૨૭૩૭૧૯૪૦ ફોન : ૦૨૭૧૮-૨૮૮૮૧૨

ડીઝાઈન : મનીષકુમાર કોષ્ટી - અમદાવાદ. (મો.) ૯૯૦૯૨૮૫૮૩૫
કુમકુમ ગ્રાફીક્સ, શીવ ચેમ્બર્સ, સી.ટી.એમ., અમદાવાદ-૨૬.

મુદ્રક : સનસાઈન પ્રિન્ટર્સ : જી-૭, રવિ એસ્ટેટ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, બી.આર.ટી.એસ. બસ સ્ટોપ સામે, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, મો. ૯૮૨૪૨૫૩૮૫૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૫, અંક : ૮, સળંગ અંક : ૨૯૬

પ્રાર્થના

હે ! મારા પ્રભુ... નિષ્કલંકી નાથ ! તમે મારા પર દયા કરજો. મારું મન, મારું ચિત્ત તમારા ચરણોમાં લાગ્યુ રહે. હવે ક્યાં સુધી આ સંસારનો બોજો માથે ઉપાડીને ભટક્યા કરીશ....?

મારું મન તમારી ભક્તિ કરવા માટે ઉધ્વર્ગામી થઈ જાય એવો સુ-અવસર મને પ્રાપ્ત કરાવી દો !

હે ! મારા સ્વામી... નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી ! હે અંતર્યામી ! હે દયાના સિંધુ ! હવે મારા તરફ જરા કૃપા દૃષ્ટિ તો કરો... આપની વરસી રહેલી અમૃતવર્ષામાં હું પવ પૂરેપૂરો ભીંજાઈ જાઉં.

હે મારા વ્હાલા મુક્તિ દાતા ! મારા મનનો મોરલો એક આપના સિવાય કોઈના પ્રત્યે ટહુકાર ન કરે. મને વિકારોથી મોહથી, મમતાથી અને કુસંસ્કારી મિત્રોથી બચાવજો.

હે સચરાચરમાં વ્યાપત ! હે સકલ સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા મહાપ્રભુજી ! હવે મને મારા નિજ સ્વરૂપમાં જગાડો. હે મારા સ્વામી ! હજુ ક્યાં સુધી આ ત્રિવિધ તાપમાં ભટકતો રહીશ ? મારું આયુષ્ય વ્યર્થ પ્રમાણમાં વહી રહ્યું છે, કંઈક તો દયા કરો. હવે... આપના શ્રી ચરણોમાં અનુરાગી થઈને હું આત્માનંદના મહાસાગરમાં ડૂબકી લગાવી ધ્યાનસ્થ થવા ઉત્સુક થઈ રહ્યો છું.

હે વિશ્વાધાર ! હે વિશ્વાનલ ! હે વિશ્વાત્મા ! મારું જીવન આપની પ્રાપ્તિ માટે છે, તો મને હવે સદા આપનું જ સ્મરણ રહે એવી મારા ઉપર કૃપા કરો, કૃપા કરો, દયા કરો ! દયા કરો !

ॐ

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n8/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

અનુક્રમણિકા

ક્રમ	લેખ	પેજ
૧.	પ્રાર્થના	૭
૨.	સંપાદકીય	૯
૩.	અખિલ ભા.ક.ક.પા.સ.સ.સ.સમાજના પ્રમુખશ્રી દેવજીભાઈ કે. ભાવાણીનું પ્રમુખીય નિવેદન	૧૦
૪.	બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી નારણબાપા મેત્રાલકંપા-શ્રદ્ધાંજલિ કાર્યક્રમ	૧૧
૫.	બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી નારણબાપા જીવન ઝરમર	૧૨
૬.	શ્રદ્ધાંજલિ-પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતોની તેમજ સત્‌પંથ સંસ્થાઓની	૧૫
૭.	કેટલાક મનુષ્યો માનવ શરીરમાં રહેવા છતાં દેવ જેવું જીવન જીવે છે	૧૮
૮.	સદગુરુવાણી	૧૯
૯.	સદ્‌ગુરુનો દિવ્ય સંદેશ	૨૦
૧૦.	સદ્‌ગુણ વચનામૃત	૨૦
૧૧.	સદ્‌ગુરુ ઉપદેશ	૨૧
૧૨.	શ્રીમદ્‌ ભગવત્‌ દશાવતાર (શ્રી રામ અવતાર)	૨૨
૧૩.	જ્યોત રે જગાવી અમે નકલંકી નાથની	૨૪
૧૪	સિમ્પી સમાજનું ગૌરવ (જાહેરાત)	૨૪
૧૫.	આત્મા સત્‌ ચિત્ત આનંદ સ્વરૂપ છે.	૨૫
૧૬.	માળા	૨૬
૧૭.	ધર્મ - સદ્‌ગુરુ - નિરાકાર	૨૭
૧૮.	દુર્યોધને ઉપકારનો બદલો ઉપકારથી વાળી પોતાનું આપેલ વચન પાળ્યું	૨૮
૧૯.	એ ઘંટડી મેં સાચવીને મૂકી દીધી છે	૨૯
૨૦.	પ્રામાણિકતાની ચરમસીમા	૩૦
	: સામાજિક કથાઓ :	
૨૧.	હૂંફના હાઈવેનું નિર્માણ અને વિચારોનું વૃંદાવન ઊભું કરો.	૩૧
	: યુવા જગત :	
૨૨.	વૃદ્ધ મા-બાપ પ્રત્યે દીકરાઓનો પ્રેમ	૩૩
૨૩.	ઉચિત મિત્ર	૩૪
	: નારી જગત :	
૨૪.	આંખ ખૂલી	૩૫
	: બાળ જગત :	
૨૫.	પોપટનો નિર્ણય	૩૭
૨૬.	ગાળ પાસે જ રહી ગઈ	૩૮
૨૭.	એમ્બ્યુલસની શોધ કોણે કરી ?	૩૮
	: આરોગ્ય અને ઔષધ :	
૨૮.	કેરીના ઔષધીય ઉપયોગો	૩૯
૨૯.	કાકડાના ઘરગથ્થુ ઉપચારો	૪૦
	: વિવિધ લેખો :	
૩૦.	સુવિચારો	૪૧
૩૧.	સુખ ભોગવવા સુખનો ભોગ આપ્યા પછી સુખની આશા મૃગજળ	૪૨
૩૨.	આધ્યાત્મિક ધ્યાન યોગ નિવાસ શિબિર	૪૩
૩૩.	અંધારીયા કાછીયા સત્‌પંથ પરિવારનું ગૌરવ (જાહેરાત)	૪૩
	: સત્‌પંથ સમાચાર દર્શન :	
૩૪.	ધર્મ પરિષદનો અહેવાલ	૪૪
૩૫.	શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બડોલકંપા	૪૫
૩૬.	શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-જામરેલાકંપા	૪૭
૩૭.	બ્રહ્મજ્ઞાન અને આત્માદર્શન શિબિર - લક્ષ્મણપુરાકંપા	૪૭
૩૮.	પ.પૂ.બ્રહ્મલીન આચાર્યશ્રી સવજીદાસજી મહારાજની બત્રીસમી પુણ્યતિથિ મહોત્સવ-પ્રેરણાપીઠ	૪૮
૩૯.	પ.પૂ. યોગ તપોનિષ્ઠ શ્રી પ્રેમદાસજીબાપુની એડવાન્સ આધ્યાત્મિક ધ્યાનયોગ શિબિર કાર્લા લોનાવાલા	૪૯
૪૦.	બાલ-બાલિકા સુસંસ્કાર શિબિર-વડાલીકંપા	૫૧
૪૧.	પ્રેરણાપીઠ તીર્થધામ સંસ્થા દ્વારા સત્‌પંથ ધર્મ પ્રચાર-પ્રસાર અભિયાન	૫૨
૪૨.	મૌન ધ્યાન યોગ શિબિર-કુકસ	૫૩
૪૩.	શ્રી ક.ક.પા.સ.સ.સ.ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયના બ્રહ્મભોજન તિથિના દાતાશ્રીઓ-જૂન-૨૦૧૮	૫૪

 • કોઈપણ સ્ત્રીએ પુરુષના અને પુરુષે સ્ત્રીના શરીરનું ચિંતન કર્યું એટલે બ્રહ્મચર્યનો ભંગ થયો. •

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n9/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

realpatidar.com

સંપાદકીય.....

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

સમષ્ટિ માત્રને જે જોડી રાખે તે ધર્મ છે. ચરાચર માત્રને ધારણ કરે તે ધર્મ છે. ધર્મ પ્રાણ સાથે સંકળાયેલો છે. તેથી પ્રાણવાન છે, તેજોમય છે. ધર્મ સર્વત્ર સમાન છે, તે બધામાં વ્યાપ્ત છે. ધર્મ ઈશ્વર રૂપ છે, તે અપરિવર્તનશીલ છે. ધર્મ આપણને સૌને નિયંત્રિત કરે છે. મનુષ્ય માત્રને સત્ય, શીલ અને ઉદારતાથી પુષ્ટ કરે છે. ધર્મનું નિયંત્રણ ન હોય તો માનવ મટી દાનવ બની જાય છે. ધર્મથી માનવ મહામાનવ એટલે કે ઈશ્વરતા પ્રાપ્ત કરે છે. ધર્મ અણુથી પરમાણુ સુધી વ્યાપ્ત છે. જેમ દરેક જગ્યાએ પવન છે તેમ દરેક જગ્યાએ ધર્મ છે. ખબર નહીં માનવી કેમ ધર્મથી અલગ રહેવા માગે છે !

ધર્મથી અલગ રહી મનુષ્ય પશુતા પ્રાપ્ત કરે છે. માતા-પુત્રનો ધર્મ, પિતા-પુત્રનો ધર્મ, ભાઈ-બહેનનો ધર્મ આપણને સમાજમાં જોવા મળે છે. ધર્મ એટલે કર્મનું કઠોર રીતે પાલન કરવું. તે તમને ફરજ ચૂકવા નથી દેતો. ધર્મ બહુ જ પ્રેમાળ પણ છે, કારણ કે તે આપત્તિ કાળે આપણને મોકળાશ અને હળવાશ પણ આપે છે.

ભગવાન અનેક સ્વરૂપે અવતાર લે છે તેમ ધર્મ પણ ઘણી વખત પોતાનું રૂપ બદલી જીવ માત્ર માટે, સૃષ્ટિ માટે, સમષ્ટિ માટે કલ્યાણકારી બને છે. માનવ માત્ર સ્વભાવે ધાર્મિક જ છે, પછી ધર્મને છોડી સુખી કેવી રીતે થાય ? માની લો કે શરીર ધર્મ કહે છે કે શરીરના પોષણ માટે ભોજન કરો પછી ભોજન છોડી સુખી કેવી રીતે થવાય ! બીમારનો ધર્મ છે દવા લો તો દવા વગર સ્વસ્થ કેમ થવાય. વિદ્યાર્થીનો ધર્મ છે ગુરુનો આદર કરવો, વિદ્યાભ્યાસ કરવો, જો તે તેનાથી વિમુખ થઈ જાય તો જ્ઞાન કેવી રીતે મેળવશે ! તે અજ્ઞાની રહેશે.

માનવ માત્ર ઉપર દયા રાખે તે ધર્મ છે. 'આત્મવત્ સર્વ ભુતેષુ યઃ પશ્ચતિ સ પષ્હિતઃ' તમે ભોજન કરો પણ બીજા કોઈ ભૂખ્યા ન રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. 'ધાર્ય તે ઈતિ ધર્મ' જે ધારણ કરે તે ધર્મ છે, 'ધર્મ એવ હતો હન્તિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ'. જે ધર્મનો નાશ કરવા માગે છે તે ખરેખર પોતાનો જ વિનાશ નોતરે છે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની સુરક્ષા કરે છે. ધર્મ રૂપી રક્ષા કવચ જેણે ધારણ કર્યું છે તેને કોઈ દિવસ કશાયની પણ બીક રાખવાની જરૂર નથી. આપણે માણસ છીએ તો માનવ ધર્મની રક્ષા કરીએ. ધર્મ પાળીએ નહીં તો મનુષ્ય અને પશુમાં શું ફરક રહેશે. હું મારો ધર્મ પાળી શકું એવો સંકલ્પ માનવી લે તો પૃથ્વી પરથી દાનવતાનો નાશ થાય. શરૂઆત આપણાથી જ થવી જોઈએ. માનવી ધર્મ ભૂલ્યો છે. ત્યારથી આધિ-વ્યાધિ અને ઉપાધિની વિટંબણામાં અટવાયેલો રહે છે. આપણી સંસ્કૃતિ શીખવે છે : 'તેન ત્યક્તેન ભુજીતાઃ'

આવો, આજે સત્સંકલ્પ કરીએ કે સત્ય જીવન, પવિત્ર જીવન, પ્રેમમય જીવન અને ચારિત્ર્યશીલ જીવન જીવીએ. માનવ માત્રના કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત બની વિશ્વ કલ્યાણની કામના કરીએ એ જ ધર્મ છે, એ જ મહાપુરુષોનો સંદેશ છે, અને એ જ પરમાત્માનું સુંદર સ્વરૂપ છે

- સંપાદક શ્રી શાંતિભાઈ ડી. પટેલ

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 8 of 23
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n10/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

realpatidar.com

Satpanth response to Umiya Mataji Unjha Judgement

સત્પંથી અનુયાયીઓ જોગ

: પ્રમુખીય નિવેદન :

પ્રમુખશ્રી : દેવજીભાઈ કે. ભાવાણી-શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સત્પંથ સમાજ, પ્રેરણાપીઠ-પીરાણા

સદ્‌ગુરુના આદેશ અનુસાર સદાચારી જીવન દ્વારા માનવ જીવનમાં સત્પંથ-સંપ્રદાયની સુવાસ પ્રસરાવી રહેલા સર્વે સત્પંથી ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુદેવ.

આપ સર્વે વિદિત છો કે પ્રેરણાપીઠ પીરાણા ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સદ્‌ગુરુ શ્રી તરફથી પ્રસ્થાપિત થયેલ હિંદુ પરંપરા મુજબ વૈદિક સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ગહનપૂર્વક ચિંતન-મનન થયું. આ પ્રસંગે આધ જગદ્‌ગુરુ શ્રી કરસનદાસ મહારાજના ભગીરથ કાર્યોને સરાહનીયતા સાથે સંસ્મરણ કરવામાં આવ્યાં અને તેમનાં અધૂરાં રહેલાં કાર્યોને ખંત અને ઉત્સાહથી આગળ ધપાવવા આપણે પ્રયત્નશીલ રહીએ તેવી ભાવના સૌ સંતો તથા સમાજના અગ્રણીય મહાનુભાવીએ દર્શાવી.

વેદ તથા પુરાણના સિદ્ધાંતો પર રચિત શુદ્ધ સનાતન સત્પંથ સંપ્રદાયને અપભ્રંશતા દ્વારા દુષિત કરવાના ઘણા પ્રયાસો ભૂતકાળમાં થયા પરંતુ સદ્‌ગુરુ મહારાજની કૃપાથી ક્રમશઃ મહત્તમ બદીઓને દૂર કરી મૂળ શુદ્ધ સ્વરૂપે સ્થાપિત કરવામાં આપણે સૌ સફળ થયા છીએ. આવા વૈદિક પરંપરા મુજબના સદ્‌ગુરુના આદેશોને દૈનિક જીવન વ્યવહારમાં વણી લઈને આપણા જીવનનું કલ્યાણ કરવામાં જ ખરી સમજદારી છે. વારિયજ્ઞ-મહાપૂજા તેમજ સદ્‌ગુરુદેવના આધ્યાત્મિક ઉપદેશોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી તથા કલિયુગમાં દસમો અવતાર શ્રી કલ્કી નારાયણ પ્રધાનપદે હોવાથી તેમના મંત્રજાપનું મહત્ત્વ હોઈ 'ૐ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃ' તેમજ પોતાના ગુરુ મહારાજશ્રીએ આપેલ મંત્રના જાપ થકી માનવજીવનને સાર્થક કરીએ તેવી અભિલાષા.

વિશેષમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી આવેલ ચુકાદાને લઈને સમાજમાં ફેલાતી ખોટી અફવાઓથી કોઈ ગેરમાર્ગે દોરાશો નહીં અને ચુકાદાને માન દઈને સકારાત્મક અર્થને સમજીને આપ સૌને આગળ વધવા હું નમ્ર નિવેદન કરું છું.

અંતમાં આપ સૌ સત્પંથી અનુયાયીઓને નમ્ર ભાવે વિનંતી કરું છું કે સદ્‌ગુરુ મહારાજે ઉપદેશીત કરેલ શિક્ષાપત્રી દ્વારા સૂચિત કરેલ સત્‌માર્ગના આદેશોને આપણા જીવન વ્યવહારના આચરણ મૂકી આપણા જીવનમાં અંગીકાર કરીએ અને તેના દ્વારા આપણે સૌ આર્થિક, પારિવારીક, સામાજિક અને આધ્યાત્મિક સ્તરે ઉચ્ચત્તમ દિવ્ય જીવન પથ પર પ્રગતિ કરીએ. સાથે સાથે શ્રી ઉમિયા માતાજી સંસ્થાની યથાર્થતા માટે 'વસુદેવ કૌટુંબિક' જેવી સામાજિક એકતાની ભાવના દ્વારા સુદૃઢ સંસ્કારી સમાજના વિકાસને સાર્થક કરીએ તેવી શુભ ભાવના અને હાર્દિક શુભેચ્છાસહ સૌને મારા જય ગુરુદેવ.

લિ. સહૃદયી
પ્રમુખ શ્રી : દેવજીભાઈ કે. ભાવાણી
શ્રી અખિલ ભારતીય ક.ક.પા.સ.સમાજ ટ્રસ્ટ-ગુરુકુળ, પ્રેરણાપીઠ-પીરાણા.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n11/mode/1up

Satpanth Sant Death, Metral Kampa

realpatidar.com

બ્રહ્મલીન પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી નારણબાપા
નારાયણધામ - મેત્રાલકંપા, તા. ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા

: શ્રદ્ધાંજલિ :

બ્રહ્મલીન પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી નારણબાપા
નારાયણધામ - મેત્રાલકંપા, તા. ખેડબ્રહ્મા, જી - સાબરકાંઠા
(બ્રહ્મધામ પ્રયાણ : તા. ૧૪-૫-૨૦૧૮, સોમવાર)

સં. ૨૦૭૪ના વૈશાખ વદ-૧૩ને સોમવાર, તા.૧૪-૫-૨૦૧૮ના બપોરના ૧૨:૩૦ કલાકે દિવંગત પ.પૂ. સંત શ્રી નારણબાપા હરિસ્મરણ કરતા કરતા પરમધામ નિવાસી થયા. તેમને તા. ૧૫-૫-૨૦૧૮, મંગળવારના દિવસે નારાયણધામ - મેત્રાલકંપા, તા. ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા સ્થાનકે સવારમાં ૯:૦૦ કલાકે અંતિમ સમાધિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ. મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દનહરિજી મહારાજ સંત કૃપા આશ્રમ (ફૈજપુર-મહારાષ્ટ્ર), પ.પૂ. મહંત શ્રી દિવ્યાનંદજી મહારાજ - અથર્વવેદી સેવાશ્રમ (કાદીયામોટા), પૂ. સંત શ્રી જયભગવાન બાપા-લક્ષ્મણપુરાકંપા, પૂ. સંત શ્રી શાંતિદાસજી મહારાજ - ગોતા કંપા, પૂ. સંત શ્રી પંકજદાસજી તથા શિષ્ય મંડળ - સત્પંથ અનુયાયીઓ તેમજ ભાવિક હરિભક્તો તથા તેમનાં સાંસારિક પરિવારજનો વગેરે અગણિત સંખ્યામાં ઉપસ્થિત રહી તેમની સમાધિએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

બ્રહ્મલીન પ.પૂ. સંત શ્રી નારણબાપાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમના નિવાસ સ્થાને બપોરના તા.૧૫-૫-૨૦૧૮ના દિવસે જ ૧૦:૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રથમ દિવંગત આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન સાથે મૂક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્યારપછી પધારેલ સંતો - મહંતો - મહાનુભાવો - શિષ્યમંડળ તેમજ મોટી સંખ્યામાં પધારેલ સત્પંથી અનુયાયીગણ તથા સાંસારિક પરિવારજનોએ તેમના દિવ્ય આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

નારાયણધામ - મેત્રાલકંપા ખાતે પ.પૂ. બ્રહ્મલીન સંત શ્રી નારણબાપાના આત્માની શાંતિ સદ્ગતિ માટે બાવન ક્રિયાની વિધિ તા. ૧૮-૫-૨૦૧૮, શુક્રવારના દિવસે રાખવામાં આવી હતી. તેમના આત્માના પુણ્યાર્થે ભંડારા તેમજ શ્રદ્ધાંજલિ તા.૨૬-૫-૨૦૧૮, શનિવારના સવારના ૮:૦૦ કલાકે રાખવામાં આવ્યાં હતાં.

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n12/mode/1up

realpatidar

Satpanth Religious Literature - Shrimad Bhagawat Dashavatar written by Imamshah

સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ રચિત

"શ્રીમદ્ ભગવત્ દશાવતાર"

(શ્રી રામ અવતાર)

(ગતાંકથી ચાલુ)

શ્રી રામ મૂર્છિત થતાં લક્ષ્મણે શ્રી રામને સાવધ કર્યા. ત્યારે શ્રી રામચંદ્ર ઊઠ્યા અને 'સીતે, સીતે' બોલતા બોલતા લક્ષ્મણ સાથે સીતાને શોધવા લાગ્યા. સીતા વિયોગથી શ્રી રામની સ્થિતિ એકદમ ભ્રમિષ્ઠ જેવી થઈ ગઈ.

બંને ભાઈ સીતાની શોધ કરતા કરતા આગળ જવા લાગ્યા. એમણે બાર હાથ લાંબાં રાક્ષસનાં પગલાં અને એમની ઉપર સીતાનાં પગલાંની મુદ્રા ઉપસેલી જોઈ. નજીક જ લોહી પડેલું અને પાંખો પડેલી દેખાઈ.

આમ તેમ શોધતાં જ તેમને જટાયુની ક્ષીણ વાણી સંભળાઈ. રામે તેને આવી અવસ્થા હોવાનું કારણ પૂછવાથી તેણે કહ્યું: 'રાવણ સીતાને લઈને લંકામાં જતો હતો. એના હાથમાંથી સીતાને છોડાવવા પ્રયત્ન કર્યો પણ એણે તમારા સોગંદ લેવરાવીને કપટથી મારી પાંખો તોડી નાખી. શ્રી રામ હવે મારાથી વધારે બોલાશે નહીં. તમારા ખોળામાં માથું મૂકી પ્રાણ છોડવો છે એ જ એક ઈચ્છા છે.' શ્રી રામના ખોળામાં માથું મૂકી જટાયુએ પ્રાણ છોડ્યા. શ્રી રામે જટાયુની અંત્યેષ્ટિ કરીને સીતાની શોધ માટે દક્ષિણ દિશામાં આગળ જવા પ્રયાણ કર્યું. ફરતા ફરતા બંને ભાઈ મયુર ગિરિ પર્વત પર આવ્યા. ત્યાં શ્રી રામ વૃક્ષ પાષાણોને સીતા સમજીને આલિંગન આપતા આપતા શોધવા લાગ્યા.

તે સમયે પાર્વતીએ સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા લીધી. તેમણે પૂછ્યું: 'તમે બહાવરા બનીને વૃક્ષ પાષાણને સીતા સમજીને કેમ આલિંગન આપો છો?'

શ્રી રામ બોલ્યા: 'માતા, હું બહાવરો બન્યો નથી પણ અવતાર ચરિત્ર બતાવીને સીતાના નિમિત્તે આ વૃક્ષ-પાષાણ રૂપ ધારણ કરેલા મહા તપસ્વીઓને આલિંગન આપી એમનો ઉદ્ધાર કરું છું.' પાર્વતીની ગેરસમજ દૂર થઈ. તેમણે રામને વરદાન આપ્યું: 'પ્રભુ રામ, તમે રાવણનો વધ કરીને સીતા સાથે આનંદથી અયોધ્યામાં જલ્દી આવશો.'

પછી શ્રી રામ ત્યાંથી કિષ્કિંધાના માર્ગે ચાલ્યા. રસ્તામાં આગળ શબરીના આશ્રમે પહોંચ્યા. શબરીએ શ્રી રામની ખૂબ ભક્તિભાવથી પૂજા કરીને ફળ ફૂલ અર્પણ કર્યાં. શ્રી રામે ત્યાં લક્ષ્મણને શબરી સાથે જ્ઞાનોપદેશ કરીને રામગીતા કહી લક્ષ્મણનો સંમોહ દૂર કર્યો.

પછી શ્રી રામ પંપા સરોવરે ગયા. એ સ્થળનું સૃષ્ટિ સૌંદર્ય અવર્ણનીય હતું. ત્યાંના વૃક્ષલતા ફળોથી ભરપૂર હતાં. એ જગ્યાએ એક સ્ફટિક શિલા પર લક્ષ્મણના ખોળામાં માથું મૂકી શ્રી રામ વિશ્રાંતિ લેવા બેઠા. પછી આગળ જતાં તેમને ઋષ્યમૂક પર્વત પર નલ, નીલ, જાંબુવંત, સુગ્રીવ, હનુમાનને જોયા. હનુમાનને જોતાં જ તેમને મનોમન ખૂબ આનંદ થયો.

શ્રી રામને જોતાં જ હનુમાન આનંદીત થયા. સુગ્રીવ, નલ, નીલ, જાંબુવંત વગેરે વાનર એ બંને ક્ષત્રિય વીરને જોઈ આશ્ચર્ય પામ્યા. એવામાં એક વટવૃક્ષ પર બેસી હનુમાનજી નાના એવા મર્કટ ચેષ્ટા કરવા લાગ્યા. મર્કટ ચેષ્ટા બતાવી તેણે શ્રી રામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. શ્રી રામે હનુમાનને ઓળખ્યા અને લક્ષ્મણને કહ્યું કે: આ વટવૃક્ષ પર બેઠેલો વાનર એણે વજ્ર પ્રમાણે ચમકનારી સુવર્ણ દિવ્ય કોપીન પરિધાન કરેલી હોવાથી એ જિતેંદ્રિય બ્રહ્મચારી એવો હનુમાન હોય એવું લાગે છે. એ સાંભળીને હનુમાને તત્કાલ શ્રી રામની આગળ કૂદકો માર્યો અને આ મારા સ્વામી છે કહીને શ્રી રામના ચરણમાં દંડવત્ પ્રણામ કર્યા.

શ્રી રામે હનુમાનને ઉઠાડીને હૃદયે લગાડયા અને 'યાવચ્ચંદ્રદિવાકરૌ' તું ચિરંજીવ થઈશ, એવો

● પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરો, વૈરાગ્ય થાય તો સંન્યાસ લો. ●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n13/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

realpatidar.com

હનુમાનને આશીર્વાદ આપ્યો. મારુતિએ શ્રી રામની સ્તુતિ કરીને પદ સેવા કરી. ત્યારે શ્રી રામે પોતાની બધી હકીકત મારુતિને કહી. ત્યારે મારુતિ બોલ્યોઃ 'સુગ્રીવ સાથે તમે મિત્રતા કરો તેની મદદ કરવાથી તમને સારો એવો લાભ થશે.'

શ્રી રામની અનુમતિ મળતાં જ હનુમાને સુગ્રીવને બોલાવી લીધા અને સર્વ હકીકત કહી. સુગ્રીવે પણ અંતઃકરણથી પોતાની હકીકત કહીને મદદ કરવા શ્રી રામને વિનવ્યા. વાલીએ નિરપરાધી સુગ્રીવને કંઈક ગેરસમજથી રાજ્ય ભ્રષ્ટ કરીને એની સ્ત્રી પર બળાત્કાર કર્યો હતો. તેથી શ્રી રામે એમની સામે યુદ્ધમાં બાણ છોડીને વાલીનો વધ કર્યો અને સુગ્રીવને રાજ્ય અને સ્ત્રી મેળવી આપ્યા. શ્રી રામે વાલીના પુત્ર અંગદને યુવરાજ્યભિષેક કરીને કાકા-ભત્રીજાની વચ્ચે સમાધાન કરી આપ્યું. આ ઉપકારથી સુગ્રીવે શ્રી રામને સીતાને શોધવા મદદ કરી.

બધા વાનર વીરોને ચોતરફ મોકલી તેમને સીતાની શોધ કરી પણ ક્યાંયથી પત્તો મળ્યો નહીં. પછી હનુમાનને બોલાવીને શ્રી રામે તેને સીતાની શોધ માટે મોકલ્યા. હનુમાને સાચવીને રાખેલા અલંકાર લાવીને શ્રી રામને બતાવ્યા. શ્રી રામે એ અલંકાર ઓળખતાં જ તેમને સીતાની ખૂબ જ યાદ આવી ગઈ અને એ શોકાતુર થઈ ગયા.

શોકવેગ ઓસર્યા પછી હનુમાને કહ્યું: 'થોડા સમય પહેલાં એક દૈત્ય એક સ્ત્રીને આકાશ માર્ગે ભગાડીને લઈ જતો હતો ત્યારે એ સ્ત્રીએ આ પોટલી ફેંકતાં એ મારી જ સામે આવી પડી. એ છોડીને જોતાં આ અલંકાર દેખાયા. આ અલંકાર જો સીતા માતાના હશે તો મને નિશ્ચિત લાગે છે એ સ્ત્રી સીતા માતા જ હશે. એને ભગાડી જનાર એ દુષ્ટ રાક્ષસ લંકાપતિ રાવણ જ હોવો જોઈએ. સ્વામી ! તમે કંઈક નિશાની આપો અને મને સીતા શોધ માટે જવાની આજ્ઞા અને આશીર્વાદ આપશો તો હું આનંદથી આ કામગીરી સ્વીકારીશ.'

શ્રી રામે તાત્કાલિક પોતાની આંગળીમાંની મુદ્રિકા આપી મારુતિને કહ્યું કેઃ 'અમે ઘરમાંથી નીકળતી વખતે કૈકેયીના મહેલમાં હું સીતાને મારા હાથે વલ્કલ પહેરાવતો હતો. સીતાના શરીરમાંથી કસ્તુરીથી પણ વિશેષ સુવાસ છે. કસ્તુરીની સુગંધ અડધા યોજન સુધી આવે છે. મારા નામનો એ અહર્નીશ જપ કરે છે.' વગેરે વાતો કહીને શ્રી રામે હનુમાનને આશીર્વાદ આપી મોકલ્યા.

કિષ્કિંધામાંથી નીકળી હનુમાન પવનવેગે મહેન્દ્ર પર્વત પર આવી પહોંચ્યા. ત્યાંથી સમુદ્ર ઉલ્લંઘીને તેને લંકામાં જવું હતું. હનુમાને બધા વાનરોને પાષાણ વૃક્ષ પર્વતને પકડવા કહ્યું. બધા હનુમાનની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. મારુતિએ ઊંચે ઉડવા પહેલાં પ્રચંડ ભુભુકાર કર્યો. તેણે આખું આકાશ ગરજવ્યું. પછી શ્રી રામનું સ્મરણ કરીને 'જય શ્રી રામ' એ નામની મોટેથી ગર્જના કરતાં મારુતિએ ઉડ્ડાન કર્યું. એની સાથે એના શરીરથી મોટાં મોટાં વૃક્ષો હાલવા લાગ્યાં. પર્વતો ડોલવા લાગ્યા, ધરતી કંપવા જેવી સર્વત્ર સ્થિતિ દેખાવા લાગી. મારુતિ આકાશ માર્ગે ઊંચે ને ઊંચે ઉડતા ગયા. દેવોને પણ એનું કૌતુક થયું.

જય શ્રી રામના સ્મરણથી સુખ રૂપે મારુતિએ કૂદકો માર્યો. લંકામાં પહોંચ્યા. ત્યાં રાવણની બહેન અને કેટલાક વૃદ્ધ રાક્ષસોને મારુતિએ લંકા ક્યાં છે ? એમ પૂછ્યું. એમણે મારુતિને લંકા બતાવી.

લંકામાં હનુમાને ઈંદ્રજીતનું, વિભીષણનું અને બીજાં અનેક ઘર શોધ્યાં પણ રામે જે વર્ણન કર્યું હતું એવી સ્ત્રી ક્યાંય દેખાઈ નહીં. પછી હનુમાને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને રાવણની બધી સ્ત્રીઓના મહેલ શોધ્યા. છેલ્લે મંદોદરીના મહેલમાં આવ્યા. ત્યાં રાવણે એક દાસીને સીતાના સમાચાર માટે મોકલી, એ હનુમાને સાંભળ્યું અને એ દાસીની પાછળ પાછળ જઈને અશોકવનમાં એક વૃક્ષ નીચે બેઠેલાં સીતામાતાને જોયાં. મારુતિને ખૂબ આનંદ થયો.

(વધુ આવતા અંકે)

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 12 of 23
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n14/mode/1up

realpatidar.com

સત્પંથ સમાચાર દર્શન

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય નમઃ ॥

Dharm Parishad Report

ધર્મ પરિષદનો અહેવાલ

તા. ૧૩,૧૪,૧૫ મે, ૨૦૧૮ના દિવસો દરમ્યાન પ્રેરણાપીઠ પીરાણા ખાતે પ.પૂ.સત્પંથ જગદ્‌ગુરુ સત્પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજની નિશ્રામાં સત્પંથ સંપ્રદાયના સાધુ, સંતો, મહંતો, ટ્રસ્ટીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓની એક સંયુક્ત ધર્મ પરિષદ યોજાઈ ગઈ.

જેમાં નીચે પ્રમાણેના મહત્ત્વના વિષયો બાબતે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવ્યા.

(૧) સાધુ, સંતો, મહંતો, મુખીશ્રીઓ, પંડિતો, ગતગંગાને અગાઉ અપનાવેલ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવું તેવું સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું.

(૨) સત્પંથ સંપ્રદાયના કોઈપણ ધાર્મિક પ્રસંગો, આયોજનો અને મેળાવડામાં એકસૂત્રતા અને ગરીમા જળવાય તે માટે તેની આચારસંહિતા (પ્રોટોકોલ) અપનાવી છે તે પ્રમાણે વર્તવું અને તેનો અમલ કરવો. જેમાં કાર્યક્રમની પત્રિકાનું પ્રાથમિક લખાણ તૈયાર કરી મુખ્ય સંસ્થાને વંચાવી અને મંજૂરી મેળવી પછી છપાવવી, જેમાં પ્રેરણાપીઠના માન્યતા પ્રાપ્ત સંતોનાં નામોની યાદી ક્રમ પ્રમાણે જળવાય તે જોવું અને કાર્યક્રમની મંજૂરી મેળવવા માટે પ્રેરણાપીઠ આવવાનું થાય ત્યારે જે તે વિભાગના ટ્રસ્ટી અથવા જવાબદાર આગેવાનોને સાથે લઈને આવવું. આચારસંહિતા અને પ્રોટોકોલ બનાવવા માટે એક અભ્યાસ જૂથની રચના કરવી.

(૩) સાધુ, સંતો, મુખીશ્રીઓએ તથા સત્પંથીઓએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને ધર્મની સાચી સમજ આપવી. કોઈપણ ધર્મ કાર્ય પ્રસંગે સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત નવીન યજ્ઞવિધિનો અમલ કરવો અને કરાવવો, તેમજ વારિયજ્ઞ પૂજા નિમિત્તે દાનમાં આવેલ રકમ (નાણાં) મુખ્ય સંસ્થા પ્રેરણાપીઠ પીરાણા સ્થાનકે પહોંચતાં કરવાં.

(૪) યુવાનો, સત્પંથ સંપ્રદાયથી વિચલિત ના થાય અને તેમની શ્રદ્ધા પ્રેરણાપીઠ સાથે જળવાઈ રહે અને ધર્મનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તેવાં આયોજનો વખતોવખત કરવાં અને જુદા જુદા વિસ્તારોમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા વિચાર ગોષ્ઠી (વર્કશોપ)નું આયોજન કરવું. યુવાનો, મહિલાઓ, બાળકો માટે તેમને રસ પડે તેવા કાર્યક્રમો યોજી ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો. જેથી તેમની આસ્થા જળવાઈ રહે અને તેમાં વધારો થાય.

(૫) પ્રેરણાપીઠની સંલગ્ન સંસ્થાઓ અને સાધુઓ, સંતો વચ્ચે સામ્યતા અને સમન્વય જળવાઈ રહે તે માટે એક કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટી પ્રેરણાપીઠ અને સંલગ્ન સંસ્થાઓ વચ્ચે સંકલન માટે પ્રયાસ કરશે.

(૬) વારિયજ્ઞ, આરતી, નિત્ય ક્રિયાઓ બીજાં કર્મકાંડો અને સત્સંગમાં એકસૂત્રતા જળવાય તે માટે મુખીમહારાજ અને કર્મકાંડ કરતા વર્ગ માટે વર્કશોપ શિબિર, ગોષ્ઠીઓનાં વખતોવખત સમજ અપાવવા માટે આયોજનો કરવાં, જેમાં દરેક બાબતની સમજ આપવી. સદ્‌ગુરુશ્રીએ આપેલ અને તેમના દ્વારા રચેલા ગ્રંથો, સાહિત્યનાં મૂળ જ્ઞાન અને ઉપદેશો જે સનાતન હિન્દુત્વ, વેદો, ઉપનિષદો આધીન છે તેની સાચી સમજ આપવી અને તે માટે એક અભ્યાસ જૂથની પણ રચના કરી અધ્યન અને સંશોધન કરવું.

(૭) સંપ્રદાયનાં આધુનિક અને પ્રામાણિક થયેલાં સાહિત્યો પ્રમાણે અમલ ના થતો હોય તેવી

● ભૂખ અને તરસને રોગ માનજો, તેને સહન કરવાની ટેવ પાડો. ●

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n15/mode/1up

realpatidar.com

વિચારસરણીવાળા વર્ગ (વિસ્તાર) સાથે સંકલન કરી માન્યતા પ્રાપ્ત કર્મકાંડો થાય અને સ્વીકૃત થયેલ સાહિત્યો પ્રમાણે કર્મકાંડો, સત્સંગ, પ્રવચનો થાય તે માટે વિશેષ પ્રયાસો કરવા અને નિશ્ચિત હેતુસહ તેના અમલીકરણ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું.

(૮) આવી ધર્મપરિષદો વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત યોજવી અને સાથે બેસી વિચાર ગોષ્ઠી કરવી અને સર્વસંમતિથી પરિસંવાદો યોજાય તેવું નક્કી કરવામાં આવ્યું અને હવે પછીની ધર્મ પરિષદ આસો સુદ - ૧૫ શરદપૂર્ણિમાના દિવસોની આસપાસ રાખવી તેવું નક્કી કરવામાં આવ્યું.

(૯) સત્પંથ સંપ્રદાયના યુવકો અને બાળકોને રસ પડે તેવાં સાહિત્યો અને પ્રકાશનો તૈયાર કરી જુદાજુદા કાર્યક્રમો અને મેળાવડાઓ યોજવા અને તેમાં એક સૂત્રતા અને ગરીમા જળવાય તે માટે તેની આચારસંહિતા (પ્રોટોકોલ) નક્કી કરવી અને તેનો અમલ કરવો.

(૧૦) યોગ અને પ્રાણાયામ, ધ્યાન માટે વિશેષ પ્રાધાન્ય આપી યુનિફોર્મ આપી ''સત્પંથ યોગ''નું મોડલ ઊભું કરી અને તેનો વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે યોગશિબિરોનું માળખું તેની પદ્ધતિ વિકસાવવા માટે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવા અને તે માટે પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુના નેતૃત્વ નીચે એક જૂથની રચના કરવી અને વધુ ને વધુ શિબિરો થાય તેવાં આયોજનો કરવાં તેવું નક્કી કરવામાં આવ્યું.

(૧૧) બંધારણની સમીક્ષા અને તેને લગતી બાબતો માટે તજજ્ઞોની એક અભ્યાસ જૂથની રચના કરી તેના માર્ગદર્શન મુજબ સમયબદ્ધ અમલીકરણ માટે પ્રયત્નો કરવા

સંકલન અને પ્રસ્તુતકર્તા :
શ્રી બી.કે. પટેલ તથા શ્રી હીરાભાઈ પટેલ.

●●●

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી જ્યોતિ મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,

મુ. બડોલ કંપા, તા. વડાલી, જી. સાબરકાંઠા (તા. ૧

Badol Kampa, Vadali, Satpanth Khana

શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી એવં મા કુળદેવી શ્રી ઉમિયામાતાની કૃપાથી પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદસહ, સંતો - મહંતોના સાનિધ્યમાં તથા બડોલકંપાના ગ્રામજનો તેમજ વડાલી તાલુકાના પશ્ચિમ વિભાગના કંપાઓના સેવાર્થી ભાઈઓના શ્રમદાનથી બડોલ કંપા સ્થિત મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવથી સંપન્ન થયો.

આ પ્રસંગે તા. ૧૭-૫-૨૦૧૮ના દિવસે બપોર પછીના ૩:૩૦ કલાકેના કાર્યક્રમમાં નિયાણીઓને દાનભેટ તથા રાત્રે દાંડિયા-રાસનો સામૂહિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

બીજા દિવસે તા.૧૮-૫-૨૦૧૮, શુક્રવારના સવારના ૭:૦૦ કલાકે સંતોનાં આગમન સાથે ઘડીવાળી દીકરીઓસહ સૌ ગ્રામજનો તથા પધારેલ ભાવિક ભક્તજનોએ સંતોનાં સ્વાગત સામૈયાં કર્યાં. ગામના મુખીશ્રીઓ શ્રી બાબુભાઈ દેવજીભાઈ, શ્રી હરજીભાઈ લદ્ધાભાઈ, શ્રી ઈશ્વરભાઈ ગંગારામભાઈ, શ્રી અમરતભાઈ દેવજીભાઈએ સંતોનાં ચંદન-તિલક દ્વારા સ્વાગત પૂજન કર્યાં. સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજના પ્રતિક સમા નિશાન તથા છડીને વધાવી નિશાનધારી પૂ. મહંત શ્રી શામળદાસજી મહારાજ અને છડીધારી પૂ. સેવક શ્રી પંકજદાસજીને ઘોડા પર બિરાજીત કરીને સન્માનિત કર્યા બાદ પ.પૂ. ધર્મધૂરંધર જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજ, પૂ. મહંત શ્રી શિવરામદાસજી મહારાજ, પૂ. સંત શ્રી તુલશીબાપા, પૂ. સંત શ્રી જયભગવાનબાપા, પૂ. સંત શ્રી શાંતિદાસજી

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n16/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

મહારાજ વગેરે સંતોને શરગારેલ રથ તથા ગામના સેવક શ્રી તુલસીભાઈએ બનાવેલ નાવની પ્રતિકૃતિમાં બિરાજમાન કરી સન્માનિત કર્યા. શોભાયાત્રા તથા સામૈયાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ધર્મસભામાં પધરામણી કરી.

ધર્મસભામાં દીપ પ્રાગટ્ય કરી સૌ સંતોએ મંચસ્થ આસન ગ્રહણ કર્યાં. કાર્યક્રમની શરૂઆત ગામની દીકરી કું. દિવ્યા ચેતનભાઈએ પ્રાર્થનાથી કરી.સંતો, મહેમાનો, વડીલો, તેમજ આર્થિક સહયોગીઓનું શબ્દોથી સ્વાગત શ્રી હરિભાઈ દેવજીભાઈએ કર્યું. ત્યારબાદ ફૂલહારથી સંતોને સન્માનિત કર્યા.

બાદમાં સંતોની દિવ્યવાણી દ્વારા મંદિરના પુનરોધ્ધારના સહયોગી દાતાઓને આશિષ આપવામાં આવ્યા. તેમજ સંતવૃદની અમૃતવાણીનું રસપાન કરી તેમના આશીર્વાદ સભા સ્થિત ભાવિક હરિભક્તોએ લીધા.

ત્યારબાદ પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદથી પૂ. મહંત શ્રી શિવરામદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના આસનની તથા કળશ - ધર્મધ્વજાની મંત્રાચ્ચાર દ્વારા પૂજન-અર્ચન વિધિ સંપન્ન થઈ. ધર્મસભાનો કાર્યક્રમ આભારદર્શન શ્રી મહેશભાઈ હરજીભાઈએ કરીને ભાર હળવો કર્યો.

બાદમાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના આસન - ધર્મધ્વજા - શિખર કળશને નિજ મંદિર (નવીન મંદિર)માં લઈ જઈ પૂ. જગદ્‌ગુરુશ્રીના વરદ્‌હસ્તે આશીર્વાદસહ વૈદિક મંત્રોચ્ચાર સાથે આદ્યશક્તિ જ્યોતિ તથા ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિવત્ કરી સ્થાપન કરવામાં આવ્યાં. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના આસનની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. ધર્મધ્વજા તથા કળશનું મંદિરના શિખર પર પ્રત્યારોપણ કરવામાં આવ્યું. પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વારિયજ્ઞ-મહાપૂજા સર્વ સંતોના સાનિધ્યમાં સંપન્ન કરી, જેમાં બ્રહ્મગાદી પૂ. મહંતશ્રી શિવરામદાસજી મહારાજે શોભાવી અને પંડિત તરીકે સેવક શ્રી પંકજદાસજી અને સેવક તરીકેની સેવા શ્રી ઈશ્વરભાઈ મુખીએ નિભાવી હતી.

મહાપૂજા પૂર્ણ થયા બાદ સૌ સંતો તથા હરિભક્તોએ બ્રહ્મભોજન (મહાપ્રસાદ)નો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગ્રામજનોએ સંતોના, વડીલોના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

આ એક દિવસીય મહોત્સવની ધર્મસભાનું સંચાલન પ્રિ.શ્રી સુરેશભાઈ પટેલ (ખેડબ્રહ્મા) તથા શ્રી નરેશભાઈ પટેલ (નારણનગર કંપા) એ સંભાળ્યું હતું.

મંદિરના પુનરોદ્ધાર માટે જહેમત ઉઠાવનાર નામી-અનામી સહયોગી દાતાશ્રીઓ, ગામના વડીલો, યુવા ટીમે ખૂબ સરસ કામગીરીનાં દર્શન કરાવ્યાં. નાની - મોટી જવાબદારીઓની વહન કરીને દરેક ગ્રામવાસી તથા વડાલી તાલુકાના પશ્ચિમ વિભાગના કંપાના સેવાભાવી સેવાર્થીઓના સહયોગથી મહોત્સવ સંપન્ન થયો

●●●

સુજ્ઞ વિજ્ઞપ્તિ

શ્રી ઈમામશાહ મહારાજ સંસ્થા પ્રેરણાપીઠ-પીરાણામાં દર્શાનાર્થે કે અન્ય કારણોસર આવતા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જ્યારે શ્રી ઈમામશાહ મહારાજ સંસ્થા પ્રેરણાપીઠ-પીરાણામાં આવે ત્યારે તેમનાં ઓળખકાર્ડ જેવાં કે ઈલેક્શન કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ, લાઈસન્સ વગેરે પોલીસ સૂચના અનુસાર સંસ્થાના અધિકૃત સંચાલકશ્રી માગે ત્યારે રજૂ કરવા માટે વિનંતી છે.

લિ.

નોંધ : રાત્રિ રોકાણ માટે ઓળખકાર્ડ ફરજિયાત છે.

શ્રી ઈમામશાહ મહારાજ સંસ્થા
વહીવટીય વિભાગ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 15 of 23
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n17/mode/1up

2018-06 -Satpanth Prakash (1420)

realpatidar.com

Jamrela Kampa, Vadali, Satpanth Khana

ૐ શ્રી નિષ્કલં... જ્યોતિ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

જામરેલા કંપા, તા. વડાલી, જી. સાબરકાંઠા (તા. ૧૭-૫-૨૦૧૮)

- પંકજકુમાર એ. પટેલ, જામરેલાકંપા

અધિક જેઠ માસ, સુદ બીજને ગુરુવાર, તા. ૧૭-૫-૧૮ના શુભ દિને પ.પૂ. પ્રાતઃસ્મરણીય ધર્મધૂરંધર જગદ્‌ગુરુ સત્‌પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદસહ વરદ્‌ હસ્તે પૂ. મહંત શ્રી શિવરામદાસજી મહારાજ, પૂ. મહંત શ્રી શામળદાસજી મહારાજ, પૂ. સંત શ્રી તુલસીબાપા, પૂ. સંત શ્રી જયભગવાન બાપા, પૂ. સંતશ્રી શાંતિદાસજી મહારાજ તથા પૂ. સેવક શ્રી પંકજદાસજીની નિશ્રામાં શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. જેમાં મહાપ્રભુજી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા, આદ્ય શક્તિ જ્યોતિ પ્રાગટ્ય સહ તથા ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી. જેમાં પાંચ મુખીશ્રીઓની ઉપસ્થિતિ ઉપરાંત અગણિત હરિભક્તો હાજર રહ્યાં.

આ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર ગામના સ્વયં ખર્ચે બનાવેલ જેમાં બાંધકામમાં બહારનું દાન ભેટ સ્વીકારેલ નથી અને આ મહોત્સવ નજીકના ત્રણ કંપા મળીને ઉજવ્યો. આજના કપરા સમયમાં નાનું સ્વરૂપ આપ્યું જે સંતોએ વંદનીય ગણાવ્યું.

સંતોએ આશીર્વાદ પાઠવતાં જણાવ્યું કે; આપણા દેહ મંદિરને શુદ્ધ કરવા આહાર શુદ્ધિનો નિયમ લેશો, દૃઢ નિશ્ચય કરશો કે તમો દરરોજ સવાર-સાંજ દેવ દર્શન માટે નિત્ય મંદિરમાં જઈશું.

તમો સર્વેએ નિયાણીને જે દાન-ભેટ આપી ઉત્તમ કાર્ય કર્યું છે, તે તમારા જીવન રક્ષાનું કવચ બની રહેશે. આપણે સૌ સર્વ દેવોને વંદન કરીએ પરંતુ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીનું પૂજન કરતા રહેશો અને સદ્‌ગોરની શિક્ષાપત્રીનું માસમાં એક વખત સામૂહિક ગાન કરશો તો આપ સૌને સત્‌પંથ ધર્મનું રહસ્ય સમજાશે. ભાવિ પેઢીનાં બાળકોને પણ સંસ્કાર આપી શકશો. છેલ્લે મહાપ્રસાદ લઈ કાર્યક્રમને વિરામ આપ્યો.

•••

બ્રહ્મજ્ઞાન અને આત્મા દર્શન શિબિર

સંતકુટીર - લક્ષ્મણપુરા કંપા, વડાલી (તા.૧૦-૫-૨૦૧૮)

શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ તેમજ કુળદેવી શ્રી ઉમિયા માતા તથા સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજની અસીમ કૃપાથી પ.પૂ. સંત શ્રી જયભગવાન બાપાના સાનિધ્યમાં સંતકુટીર લક્ષ્મણપુરા મુકામે તા.૧૦-૫-૨૦૧૮ના રોજ બ્રહ્મજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભાગ લેવા માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. સવારે ૮:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી બે સત્રમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સત્રમાં પ.પૂ. સંત શ્રી જયભગવાન દ્વારા બ્રહ્મજ્ઞાનના દૃષ્ટાંત સહિતના સત્સંગનો કાર્યક્રમ અને બીજા સત્રમાં સર્વે શિબિરાર્થીઓને આત્માના સાક્ષાત્કારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં તમામ શિબિરાર્થીઓને પ.પૂ. સંતશ્રી જયભગવાન બાપા દ્વારા આત્માનાં પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં હતાં. આત્માનાં પ્રત્યક્ષ દર્શનનો અમૂલ્ય લહાવો લઈ તમામ શિબિરાર્થીઓએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. બીજા સત્રના અંતે શિબિરાર્થીઓએ મૂઝવતા પ્રશ્નોની રજૂઆત કરી, તેના પ.પૂ. સંત શ્રી જયભગવાનબાપા દ્વારા પ્રશ્નોની શંકાઓનું સમાધાન કરાવીને જવાબો આપ્યા હતા.

બપોરના સમયે શિબિરાર્થીઓને સાત્ત્વિક ભોજન મળે તે માટે લક્ષ્મણપુરાકંપા અને બડોલકંપાના ભાઈઓ તથા બહેનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં બહેનોએ પોતાના હાથે રસોઈ બનાવીને સર્વેને સાત્ત્વિક ભોજન જમાડીને શ્રમદાનનો અમૂલ્ય લાભ લીધો હતો.

•••

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n18/mode/1up

realpatidar.com

પ.પૂ. બ્રહ્મલીન આચાર્યશ્રી સવજીદાસજી મહારાજની બત્રીસમી પુણ્યતિથિ મહોત્સવ

પ્રેરણાપીઠ-પીરાણા (તા.૧૧-૫-૨૦૧૮)

- રમણલાલ કે. રૂડાણી,વાવકંપા

સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની અસીમ કૃપાથી તેમજ પ.પૂ. ધ.ધૂ. પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય સત્પંથાચાર્ય જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજના શુભ આશીર્વાદથી પ્રેરણાપીઠ પીરાણા ખાતે પરંપરાગત રીતે સંવત -૨૦૭૪ના વૈશાખ વદ - ૧૧ ના શુભ મંગલ દિને પ.પૂ. બ્રહ્મલીન પ્રેરણાપીઠના એકવીસમા ગાદીપતિ આચાર્યશ્રી સવજીદાસજી મહારાજની બત્રીસમી પુણ્યતિથિ મહોત્સવ સર્વ શિષ્યબંધુઓ તથા ભાવિકભક્તોની ઉપસ્થિતિમાં ખૂબ જ આનંદ - ઉલ્લાસ તેમજ ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ ગયો.

મહોત્સવના આગળના દિવસથી જ સર્વ શિષ્ય બંધુઓએ સાંજના સંધ્યા સેવા - આરતીનો લાભ લીધેલ તેમજ સાંજની નિત્ય વારિયજ્ઞ મહાપૂજાનો જયોતિ મંદિરમાં લાભ લીધેલ. પૂજા પૂર્ણાહુતિ બાદ ગુરુમહારાજની સમાધિ સ્થળે ગુરુજીનાં ગુણગાન ગાવા સંતવાણી સત્સંગનો કાર્યક્રમ રાખેલ. જેનો સર્વ શિષ્ય બંધુઓ તથા ભાવિકોએ અમૃતવાણીનો લાભ લીધો હતો. પ્રસાદ વિતરણ બાદ સત્સંગને વિરામ આપેલ.

મહોત્સવના શુભ મંગલ અવસરે વૈશાખ વદ - ૧૧ ના દિને સવારના નિત્યકામથી પરવારી સવારનો ચા-નાસ્તો લીધા બાદ સર્વ શિષ્યબંધુઓ - સંતો - ભાવિકો - મુખીમહારાજશ્રીઓ વગેરે ગુરુજીની સમાધિ સ્થળે ભક્તિભાવ વાતાવરણમાં એકત્ર થઈ ગુરુજીના ગુણગાન રૂપી દોહા-છંદ - ભજન - ધૂનની રમઝટ જમાવી સૌ ભક્તિરસમાં તરબોળ થયા હતા. સમાધિ સ્થળે સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરી સંતો તથા ટ્રસ્ટીઓ તેમજ મુખી મહારાજશ્રીના કરકમલોથી ફૂલની ચાદર જયઘોષ સાથે ઓઢાડેલ. ગુરુ મહારાજની છબીને ચંદન-ચોખાથી તિલક કરી પુષ્પમાળા ચઢાવી પૂજન કરી સર્વ શિષ્યો તથા ભાવિકોએ સમૂહમાં આરતી ગાન કરી મહાઆરતીના લાભ લઈ ભાવ વિભોર બન્યા હતા. તેમજ ગુરુ મહારાજની છબી સમક્ષ ગત વર્ષમાં થયેલ ભૂલોનો એકરાર કરી આગામી વર્ષમાં આપના વચને ચાલવા સદ્‌બુદ્ધિ - સદ્‌વિચાર - સન્મતિ આપજો એવી સહૃદયે પ્રાર્થના કરેલ. ત્યારબાદ કેટલાક શિષ્યોએ તથા સંતોએ ગુરુજીના અનુભવની વાતો તથા પરચા વિષે ઉદ્‌બોધનના રૂપમાં કહેલ. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરી ગુરુપૂજનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

ગુરુપૂજન કાર્યક્રમ બાદ જયોતિ મંદિરમાં ધર્મસભાનું આયોજન કરેલ. જેમાં મંચસ્થ પૂ.મહંતશ્રી શામળદાસજી મહારાજ, પૂ. મહંતશ્રી રવિદાસજી મહારાજ, મુખી મહારાજશ્રી નારણબાપા, ટ્રસ્ટીશ્રી ખીમજીભાઈ તથા વડીલ શિષ્ય બંધુશ્રી વાલજીબાપા વગેરે મહાનુભાવોએ સ્થાન ગ્રહણ કરેલ. સૌ પ્રથમ સંતોનું ચરણામૃત શ્રી અમૃતભાઈ ડાહ્યાભાઈ ઘોઘારી (પણસોરા) એ સજોડે લીધેલ. શ્રી યોગેશભાઈ ચુનીભાઈ રૂડાણી (નાસિક) સજોડે સંતોનું ચંદન - ચોખાથી તિલક કરી પૂજન કરેલ. શ્રી બાબુભાઈ રામજીયાણી (રવીપુરા-ઈટાડી) એ સૌનું શાબ્દિક સ્વાગત કરેલ. તેમજ મંચસ્થ સૌ સંતો - મહાનુભાવોનું આજના ચા-નાસ્તા તથા ભોજન દાતાના પ્રતિનિધિશ્રીઓએ ફૂલહારથી સ્વાગત કરેલ. મંચસ્થ સર્વ સંતો મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ તેમજ ગુરુ શિષ્યના સંબંધ, ગુરુમંત્રની શક્તિ વિષે દાખલાઓ આપી ઊંડી સમજ આપી તેમજ ગુરુમંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી સ્મરણ કરવાથી અવશ્ય પરિણામ મળે.

"સંત બીજ પલટે નહિ, ભલે જુગ જાય અનંત,
ઉંચ નીચ ઘર અવતરે, પણ આખર સંતના સંત."

નદીનું મૂળ ન જોવાય અને સંતનું કુળ ન જોવાય. વગેરે વાણી કરી સંતોએ અંતરના આશીર્વાદ પાઠવેલ. પૂ. મહંતશ્રી શામળદાસજી મહારાજે આવતા વર્ષે મોટી સંખ્યામાં તિથિ ઉજવવા આવવા સર્વેને આમંત્રણ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1420/page/n19/mode/1up

realpatidar.com

પાઠવેલ. શ્રી અંબાલાભાઈ રામજીયાણી (રવીપુરા, ઈટાડી) એ જરૂરી સૂચનો કર્યા બાદ આભારવિધિ કરેલ.

ધર્મસભાને વિરામ આપ્યા બાદ જ્યોતિ મંદિરમાં જ વારિયજ્ઞ મહાગુરુપૂજાનો સર્વ સંતો- શિષ્યો ભાવિકોએ લાભ લીધેલ. વારિયજ્ઞમાં બ્રહ્માસન શ્રી બાબુભાઈ રામજીયાણી (રવીપુરા), સેવક તરીકે શ્રી ચીમનભાઈ ભગત (નહેરુકંપા), પંડિત આસન શ્રી રમણભાઈ રૂડાણી (વાવકંપા) એ શોભાવેલ. ત્યારબાદ ભોજન રૂપી પ્રસાદ ગ્રહણ કરી સૌએ સ્વગૃહે પ્રયાણ કરેલ.

મહોત્સવમાં ચા-નાસ્તા - પ્રસાદના દાતાશ્રી લક્ષ્મી કન્સ્ટ્રકશન (નાસિક) શ્રી ચુનીભાઈ હંસરાજભાઈ રૂડાણી તથા બપોરના ભોજન દાતા શ્રી ડાહ્યાભાઈ માવજીભાઈ ઘોઘારી પરિવાર (પણસોરા) હતા.

સમગ્ર મહોત્સવ સફળ બનાવતા શ્રી રમણભાઈ (વડોદરા)એ ખૂબ જ જહેમત ઉઠાવેલ. સમગ્ર મહોત્સવનું સુચારું સંચાલનશ્રી રમણભાઈ મુખી (વાવકંપા) એ પોતાની આગવી શૈલીથી કરેલ.

●●●

પ.પૂ. યોગ તપોનિષ્ઠ સંત શ્રી પ્રેમદાસજીબાપુની
એડવાન્સ આધ્યાત્મિક ધ્યાનયોગ શિબિર-૨
કાર્લા લોનાવાલા (તા. ૪, ૫, ૬ એપ્રિલ-૨૦૧૮)

- પ્રકાશભાઈ વાડીયા, પૂના

શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી તેમજ સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની કૃપાથી અને પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદથી પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ જૈન તીર્થસ્થાન કાર્લા લોનાવાલા (મહારાષ્ટ્ર) સ્થાનકે તા. ૪, ૫, ૬ એપ્રિલ-૨૦૧૮ના રોજ પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસ બાપુના સાનિધ્યમાં એડવાન્સ આધ્યાત્મિક ધ્યાન યોગ શિબિરનું મહારાષ્ટ્ર ઝોન તરફથી બે મહીનાના ટૂંકાગાળામાં ફરીથી આયોજન કરવામાં આવ્યું હતું.

પ.પૂ. આદ્ય જગદ્‌ગુરુ શ્રી કરસનદાસજી મહારાજના આદેશ અને આશીર્વાદથી અને પ.પૂ. યોગ તપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ ધ્યાન યોગ શિબિર વચ્ચેના સમયમાં સુષુપ્ત અવસ્થામાં હતી. જે યુવાનો અને વડીલોની જીજ્ઞાસા અને ઉત્કંઠાથી ફરીથી ધ્યાનયોગ શિબિરનું કાર્લા લોનાવાલા ખાતે આયોજન થયું.

પ્રથમ દિવસે સવારમાં સર્વે શિબિરાર્થી ભાઈ-બહેનો શિસ્તબદ્ધ બે હરોળમાં ઊભા રહીને પૂ. પ્રેમદાસબાપુનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શિબિર હોલમાં શિબિરમાં ઉપસ્થિત સર્વે મુખીશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચંદન-તિલક અને ફૂલહારથી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન, સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ, શ્રી ઉમિયા મા તથા શ્રી ગણપતિદાદાની પ્રતિમાનું પૂજન કરી શિબિરના પ્રણેતા એવા પ.પૂ. યોગ તપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુનું સ્વાગત કોલ્હાપુરવાળા ડૉ. કાન્તિભાઈ ભાદાણીએ સજોડે ચંદન-તિલક અને પુષ્પહાર અને આરતીથી સ્વાગત પૂજન કર્યું હતું. શ્રી નરેન્દ્રભાઈ મુખી ખારઘર (મુંબઈ)એ સૌ શિબિરાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા.

શિબિરના સંચાલક શ્રી દિનેશભાઈ પારસીયાએ (ખારઘર) શિબિરની શરૂઆત કરતાં જણાવ્યું કે; અત્યાર સુધી શિબિરોમાં આપણે પ્રાયમરી જ્ઞાન મેળવ્યું હતું. હવે તેનાથી આગળ વધીને નવું જ્ઞાન મેળવવા માટે આ શિબિરનું આયોજન કરેલ છે અને સાથે ધાર્મિક્તા અને આધ્યાત્મિક્તા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.

● બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે તે શિવ. ●

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n20/mode/1up

realpatidar.com

ત્યારબાદ પૂ. બાપુશ્રીને ધ્યાનયોગ શિબિરમાં જ્ઞાન પીરસવાની વિનંતી કરી હતી.

પ.પૂ. બાપુશ્રીએ ત્રિદિવસીય શિબિરમાં સવારના ૫.૦૦ કલાકથી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધીના લાંબા સમય માટે દિવસના ચાર સત્ર કરી સર્વેને ધ્યાનયોગના માર્ગે આગળ લઈ જવા ઘણું બધું જ્ઞાન દૃષ્ટાંત સાથે સમજાવ્યું હતું. પૂ. બાપુશ્રીએ ધ્યાનયોગની થીયરી પ્રેક્ટીકલ અને અનુભવ દ્વારા શિબિરાર્થીઓને કરાવવામાં આવશે તેમ જણાવી શરૂઆત કરી. તેમાં બાપુશ્રીએ શરીર, મન અને ચિત્ત વિશે ઊંડી સમજ આપી હતી તથા મનને કઈ રીતે ધ્યાનમાં જોડવું તેની ટેકનીકો બતાવી. તે ઉપરાંત બાપુશ્રીએ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને અહંકારને શાંત કરવા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આજના ભણેલા યુવાનો અને વડીલોને ઉદાહરણો સાથે સમજાવ્યું. બાપુશ્રીએ આ શિબિર દરમ્યાન પિચ્યુંટરીગ્લેંન્ડ અને પીનીયલગ્લેંન્ડની ગ્રંથીને કેવી રીતે જાગૃત કરવી તે વિગતે સમજાવ્યું હતું અને આ ગ્રંથી ખુલવાથી શું ફાયદા થાય છે તે પણ સમજાવ્યું હતું. પૂ. બાપુશ્રીએ ઈંગલા, પિંગલા અને સુષુમણા નાડીની સમજ આપી અને શરીરના સાત ચક્રો મુલાધાર ચક્રથી સ્વાધિષ્ઠાનચક્ર-મણિપુરચક્ર-અનાહતચક્ર - વિશુદ્ધચક્ર - આજ્ઞાચક્ર અને સહસ્રાધારચક્રની યાત્રા કરાવીને તેને કેવી રીતે જાગૃત કરવાં તે માટે મુદ્દાઓનું જ્ઞાન આપી અને પ્રેક્ટીકલ કરી બતાવ્યું હતું તથા બાપુશ્રીએ આત્મા અને પરમાત્મા સાથેની ઓળખાણના રસ્તા તથા તેમાં આવતા અવરોધો વિશે સમજાવ્યું હતું. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે ધ્યાનયોગ માટે આપેલ શરીર શુદ્ધિ, હૃદય શુદ્ધિ અને અંતઃકરણ શુદ્ધિ કરવા માટેની રોજીંદી પ્રક્રિયાઓ સમજાવી હતી. બાપુશ્રીએ મૌનના ફાયદા સમજાવી અને દરેક શિબિરાર્થીઓને એક દિવસ માટે સંપૂર્ણ મૌન રખાવ્યું હતું. રોજ રાત્રી સત્રમાં બાપુશ્રીએ શિબિરાર્થીના મનમાં ઉદ્‌ભવતા પ્રશ્નોનું સરળ જવાબ આપી નિરાકરણ કર્યું હતું.

ત્રિદિવસીય શિબિરમાં ૧૧૦ શિબિરાર્થીઓ હતા. જેમાં ત્રેવીસ વર્ષના યુવાનોથી પાંસઠ વર્ષના વડીલોએ ભાગ લીધો હતો. જેમાં ૬૦ બહેનો, ૫૦ ભાઈઓએ ભાગ લીધેલ હતો. તેમાં મુંબઈ, પૂના, કોલ્હાપુર, નાશિક અને ગુજરાતના સુરત, નવસારી, વડોદરા, ખેડબ્રહ્મા, મોડાસા, બાયડ વિભાગોમાંથી તથા કચ્છમાંથી શિબિરાર્થીઓએ ભાગ લીધેલ હતો.

પ.પૂ. બાપુશ્રીએ જીજ્ઞાસુ મનુષ્ય માત્ર તમામને શિબિરમાં ભાગ લેવા માટે આદેશ આપ્યો હતો. તે પ્રમાણે નામો શિબિરમાં ભાગ લેવા માટે ઘણાં બધાં આવ્યાં હતાં પરંતુ રહેવા તથા ધ્યાન હોલની ૧૧૦ની સંખ્યાની મર્યાદા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે સંખ્યા લેવામાં આવી હતી. જગ્યાના કારણે ઘણા ભાવિકોને ના પાડવી પડી હતી. આગામી શિબિરોમાં તેમને જરૂરથી લેશું એમ જણાવીને ભાવિકોને સમજાવ્યા હતા.

આ શિબિર દરમ્યાન ઘણા બધા શિબિરાર્થીઓએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા તેમાં તેમણે જણાવ્યું હતું કે ; આજ સુધી અમોએ નહોતું જાણ્યું તે અહીં નવું જાણવા મળ્યું અને આગળ વધવા માટેનો રસ્તો મળ્યો તથા અમને ત્રણ દિવસ દરમ્યાન પોતાને થયેલા અનુભવો અને આનંદનું વર્ણન કર્યું હતું.

વડોદરાથી આવેલ શ્રી પરેશભાઈ ખાસ ઉપસ્થિત રહીને સાઉન્ડ અને સમગ્ર શિબિરનું રેકોર્ડીંગનું કામ સંભાળ્યું હતું.

આ શિબિરને યશસ્વી કરવા માટે પૂ. બાપુશ્રીના સેવક શ્રી ઘનશ્યામભાઈની ખાસ અનેરી સેવાનો લાભ મળ્યો હતો તથા પૂનાથી શ્રી પ્રકાશભાઈ વાડીયા, શ્રી અશોકભાઈ વેલાણી, શ્રી દિનેશભાઈ ધોળુ, શ્રી મનોજભાઈ પોકાર, મુંબઈથી શ્રી સુધીરભાઈ સી.એ., કોલ્હાપુરથી શ્રી રાજેશભાઈ ભાદાણીએ સારી એવી જહેમત ઉપાડી શિબિરને સફળ બનાવવા માટે ઉમદા સહયોગ આપ્યો હતો.

અંતમાં આભારદર્શન શ્રી અશોકભાઈ વેલાણી દ્વારા કરવામાં આવેલ હતું અને સર્વે આવેલ હરિભક્તોએ પૂ. બાપુશ્રીના આશીર્વાદ લીધા હતા. બપોરનું બ્રહ્મભોજન લઈને શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.

●●●

● પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે એ જીવ. ●

realpatidar.com

realpatidar.com

બ્રહ્મલીન પ.પૂ. આચાર્ય શ્રી સવજીદાસજી મહારાજની બત્રીસમી પુણ્યતિથિ મહોત્સવ

પ્રેરણાપીઠ - પીરાણા (તા. ૧૧-૫-૨૦૧૮)

ઉપરોક્ત પ્રસંગે પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી
શ્રી નાનકદાસજી મહારાજનાં પૂજન-અર્ચન

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન
પૂ. સંતો-મહંતો-મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન બ્રહ્મલીન પૂ. આચાર્યશ્રી સવજીદાસ મહારાજના શિષ્યમંડળ તથા ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે બ્રહ્મલીન પૂ. આચાર્ય શ્રી સવજીદાસજી મહારાજનાં આરતી-પૂજન-અર્ચન
પૂ. મહંત શ્રી રવિદાસજી મહારાજ, પૂ. મહંત શ્રી શામળદાસજી તથા ખીમજીબાપા કરી રહ્યા છે.

ઉપરોક્ત પ્રસંગે બ્રહ્મલીન પૂ. આચાર્ય શ્રી સવજીદાસજી મહારાજનાં આરતી-પૂજન-અર્ચન
પૂ. શ્રી વાલજીબાપા તથા અન્ય શિષ્યો કરી રહ્યા છે.

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n22/mode/1up

realpatidar.com

પ્રેરણાપીઠ તીર્થધામ દ્વારા સત્પંથ ધર્મ પ્રચાર-પ્રસાર અભિયાન

સત્પંથ પ્રકાશન સમિતિના ઉપક્રમે 'પ્રેરણારથ' દ્વારા સત્પંથ ધર્મ પ્રચાર-પ્રસાર યાત્રા

અરવલ્લી જીલ્લો : ધનસુરા - મોડાસા - ભિલોડા વિભાગ (તા. ૧-૫-૨૦૧૮ થી ૧૦-૫-૨૦૧૮)

ધર્મ પ્રચાર-પ્રસાર અંતર્ગત : અરવલ્લી જીલ્લાના ધનસુરા, નારણપુરાકંપા, કોઠીકંપા, અમરગઢકંપા, શીવપુરાકંપા, મોહનપુરાકંપા, હેમપુરાકંપા, કરસનપુરાકંપા, સુખપુરાકંપા, લીંભોઈકંપા, રામપુરાકંપા, ભવાનીપુરાકંપા, ખિલોડીયાકંપા, પ્રેમનગરકંપા, નાંદીસણકંપા, તળાવકંપા, મણીપુરકંપા, ગણેશપુરાકંપા, રાજલીકંપા વગેરે સ્થળોએ ધર્મ પ્રચાર-પ્રસાર યાત્રા

realpatidar.com

https://archive.org/details/bk1420/page/n23/mode/1up

realpatidar.com

પ્રેરણાપીઠ તીર્થધામ દ્વારા સત્પંથ ધર્મ પ્રચાર-પ્રસાર અભિયાન

સત્પંથ પ્રકાશન સમિતિના ઉપક્રમે 'પ્રેરણારથ' દ્વારા સત્પંથ ધર્મ પ્રચાર-પ્રસાર યાત્રા

અરવલ્લી જીલ્લો : ધનસુરા - મોડાસા - ભિલોડા વિભાગ (તા. ૧-૫-૨૦૧૮ થી ૧૦-૫-૨૦૧૮)

ધર્મ પ્રચાર-પ્રસાર અંતર્ગત : અરવલ્લી જીલ્લાના ધનસુરા, નારણપુરાકંપા, કોઠીકંપા, અમરગઢકંપા, શીવપુરાકંપા, મોહનપુરાકંપા, હેમપુરાકંપા, કરસનપુરાકંપા, સુખપુરાકંપા, લીંભોઈકંપા, રામપુરાકંપા, ભવાનીપુરાકંપા, ખિલોડીયાકંપા, પ્રેમનગરકંપા, નાંદીસણકંપા, તળાવકંપા, મણીપુરકંપા, ગણેશપુરાકંપા, રાજલીકંપા વગેરે સ્થળોએ ધર્મ પ્રચાર-પ્રસાર યાત્રા

realpatidar.com

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18-05-2012.
Registered Under Postal Registration No. GAMC - 1830/2018-2020 By S.S.P. Ahmedabad City DN Valid up to 31st December 2020
Licence to post without Prepayment No. PMG/HQ/006/2018-2020 valid up to 31-12-2020
Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિદ્ધ થતું માસિક

if not delivered please return to :

સત્પંથ પ્રકાશ
સત્પંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

Printed, and Published by **SHANTIBHAI D. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Sunshine Printers**, G-9, Ravi Estate, Rustam Mill Compound, Opp. BRTS Gurudhwara Bus Stop, Dudheswar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Prernapith, At - PIRANA - 382425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHANTIBHAI D. PATEL**

realpatidar.com